

INS Kiltan delivers 15 tons of flood relief material to Cambodia

December 30, 2020

આઈએનએસ કિલ્ટન કંબોડિયા ને ૧૫ ટન જેટલી પૂર રાહત સામગ્રી પહોંચાડી.

30 ડિસેમ્બર, 2020

જ્યારે ભારતીય નૌકાદળના ભારતીય નૌકા શિપ "આઈએનએસ કિલ્ટન" દ્વારા કંબોડિયામાં પૂરગ્રસ્ત લોકો માટે 3000 રાહત કીટ સહીત 15 ટન જેટલી પૂર રાહત સામગ્રી પહોંચાડવામાં આવી ત્યારે ભારત અને કંબોડિયા વચ્ચેના વર્ષો જુના સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધોમાં આજે એક નવો ગૌરવપૂર્ણ અધ્યાય લખાયો હતો. 29 ડિસેમ્બર 2020 ના રોજ ભારતીય નૌકા શિપ "આઈએનએસ કિલ્ટન" ભારતીય નૌકાદળના મિશન સાગર- III હેઠળ કંબોડિયામાં સિહાનુકવિલે બંદરે પહોંચ્યું. આ મિશન ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન ફોર સાગર - આ વિસ્તારમાં સૌને માટે સુરક્ષા અને વિકાસ - અનુસાર કાર્યરત છે.

રોયલ કંબોડિયન નેવી વતી, કોમોડોર સોખેમેરાએ આઈએનએસ કિલ્ટનની મુલાકાતનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત સરકાર નો કંબોડિયાના લોકોને રાહત આપવાના આ માનવતાવાદી વલણ બદલ આભાર માન્યો હતો. 30 ડિસેમ્બર 2020 ના રોજ સિહનૌકવિલે બંદર ખાતે યોજાયેલ એક સમારોહમાં ભારત સરકાર વતી શ્રી બી. સુબ્બા રાવ, ચાર્જ ડી અફેર્સ અને સેકન્ડ સેક્રેટરી (પોલ અને કોમ), એમ્બેસી ઈન્ડિયા, ફ્નોમ પેન્હે 15 ટન પૂર રાહત સામગ્રી શ્રી હેંગ સેમોએન, આપત્તિ પ્રબંધન માટે ની રાષ્ટ્રીય સમિતિ ના કાયમી ઉપપ્રમુખ અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી શ્રી સેમ્ડેક ટેકો હુન સેન ના સલાહકાર ને આપી હતી. કંબોડિયાની રોયલ સરકાર વતી પૂર રાહત સામગ્રી ને સ્વીકારતી વખતે, શ્રી સામિયોનેએ બંને દેશો વચ્ચેના મિત્રતાના મજબૂત સંબંધો ને યાદ કર્યા હતા અને કંબોડિયાના પૂરગ્રસ્ત લોકોની મદદ બદલ ભારત સરકાર નો આભાર માન્યો હતો.

"મિશન સાગર" અંતર્ગત કંબોડિયામાં 15 ટન પૂર રાહત સામગ્રી પહોંચાડવા માટે આઈ.એન.એસ. કિલ્ટનની સિહાનૌકવિલે બંદરની મુલાકાત એ મૈત્રીપૂર્ણ વિદેશી દેશોને ભારતની માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (એચ.ડી.આર.) સહાય નો એક ભાગ છે અને કંબોડિયા જેવા નજીક ના દરિયાઈ પાડોશી દેશ ને ભારત જે રીતે મહત્વ આપે છે તે દર્શાવે છે.

30 ડિસેમ્બર, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.

